

INQUIRIES

No.:LDCE/General Dept/Catering/2017/366

L.D. College of Engg.,
Navrangpura,
Ahmedabad - 380015.
Date: 23/02/2017

SUB: Quotation for providing Catering Services

Sir,

The quotation as per above subject should be sent in a sealed cover duly superscripted as QUOTATION for the following items in table 1 to table 3 due on **17 March 2017** before 5 pm.

ટેબલ ૧

Items	Quantity	એક ડીશ દીઠ વધુમાં વધુ સ્વીકાર્ય ભાવ
પાઉંભાજી, પુલાવ, ગુલાબ જાંબુ (નંગ ૨), સલાડ, છાશ, મિનરલ વોટર, પેપર નેપકીન.	૧ થી ૨૦૦ ડીશ સુધી	
	૧ થી ૫૦૦ ડીશ સુધી	
	૧ થી ૧૦૦૦ ડીશ સુધી	૧૦૦/-
	૧૦૦૦ ડીશ થી વધારે	૧૦૦/-

ટેબલ ૨

Items	Quantity	એક ડીશ દીઠ વધુમાં વધુ સ્વીકાર્ય ભાવ
• સવારે ચા-કોફી , નાસ્તો (બટાકા પૌવા, સેવ ખમણી, ઈડલી, સમોસા, ઉપમા કે તેના સમકક્ષ જે નક્કી થાય તે) • ગુજરાતી / પંજાબી ફૂલ ભાણું , સ્વીટ, ફરસાણ, પાપડ, સલાડ, છાસ સાથે • મિનરલ વોટર, પેપર નેપકીન.	૧ થી ૫૦ ડીશ સુધી	
	૧ થી ૨૦૦ ડીશ સુધી	
	૨૦૦ ડીશ થી વધારે	

ટેબલ ૩

Items	Quantity	એક ડીશ દીઠ વધુમાં વધુ સ્વીકાર્ય ભાવ
• ગુજરાતી / પંજાબી ફૂલ ભાણું, સ્વીટ, ફરસાણ, પાપડ, સલાડ, છાસ સાથે • મિનરલ વોટર, પેપર નેપકીન.	૧ થી ૫૦ ડીશ સુધી	
	૧ થી ૨૦૦ ડીશ સુધી	
	૨૦૦ ડીશ થી વધારે	૧૨૦/-

Terms and Conditions:

1. Tenderer should be a registered and licensed contractor. Appropriate documents/Certificates issued from appropriate authorities should be enclosed to support this.
2. The tenderer should have KST/CST/VAT/TIN/PAN Registration. Copy should be enclosed.
3. Quoted price should be inclusive of all taxes and duties per dish and accordingly final bill to be submitted after satisfactory completion of work order.
4. All tenders and covers should bear the name and address of the tenderer and all the pages of the tender document must bear the seal and signature of the tenderer with page numbering.
5. The tenderer should be prepared to come to L. D. College of Engineering to take part in discussions, if required at a short notice.
6. The Contractor shall be solely responsible either for any injury, damage, accident to the workman employed by the agency or for any loss or damage to the equipment/property in the areas of work as a result of negligence/carelessness of its workers.
7. Adequate number of manpower should be supplied so that the work is done in specified time.
8. Contractor has to provide and use all necessary utensils and furniture and all other such items for catering and counters of serving as per the requirement.
9. Contractor has to make sure to clean the place after usage and has to lift all garbage regarding food and catering.
10. The specifications of each items quoted should be completely described in the quotation. These specifications should be the same as those given in the statement enclosed herewith.
11. Rates must be quoted in specific units mentioned in the tender form.
12. The validity period for the quotation should be **12 Months** from the date on which the tender is due.
13. Purchase order will be given as per the requirements of the office. Contractor has to provide the goods as per order at the place suggested in work order.

14. The payment will be done only if work will be found satisfactory and all conditions will be followed strictly by the contractor.
15. The Contractor must maintain hygienic, cleanliness and safety requirements. Contractor has to submit the acceptance and statement that he will follow all the conditions laid down here on Rs. 100/- stamp paper when order is given.
16. This office reserves the right to reject any or all quotations without assigning any reasons.
17. In case of any dispute or misunderstanding, the decision of the undersigned /Principal shall be final.

By Order of
PRINCIPAL